

(ICAN) સંસ્થાને શાંતિ માટેનું નોબેલ પ્રાઇઝ :

નોબેલ શાંતિ પુરસ્કાર માટે ચાલુ વર્ષે પરમાણુ હથિયારોના ખાત્મા માટે કામ કરતી સંસ્થા ઈન્ટરનેશનલ કેમ્પેઇન ટુ એબોલિશ ન્યુક્લિયર વેપન્સ(આઈસીએએન) ની પસંદગી કરાઈ છે. નોર્વેમાં નોબેલ પારિતોષિક સમિતિએ શુક્રવારે આ અંગે જાહેરાત કરી હતી. સમિતિના ચેરમેન બેરિટ રેઈસ-એન્ડરસને કહ્યું કે પરમાણુ હથિયારોના ઉપયોગથી થતી ભયાવહ માનવીય તબાહી તરફ ધ્યાન દોરવા અને તેમના પ્રયાસોથી ઘાતક હથિયારોના ઉપયોગ પર પ્રતિબંધ મૂકવા માટે સંધિ કરાવતી આઈસીએએનને વર્ષ 2017નું નોબેલ પારિતોષિક અપાશે.

- આઈસીએએન 10 વર્ષોથી વૈશ્વિક સ્તરે પરમાણુ હથિયારો પર પ્રતિબંધ મૂકવા માટે સતત પ્રયત્નશીલ છે. આઈસીએએન 101 દેશોમાં 468 જેટલી સહયોગી સંસ્થાઓ છે. તેની શરૂઆત ઓસ્ટ્રેલિયામાં થઈ હતી અને વિયેનામાં 2007માં સત્તાવાર રીતે તેની શરૂઆત થઈ હતી.

2017ના નોબેલ પ્રાઇઝ વિનર :

- * **લિટરેચર:** બ્રિટનના જાપાનીઝ મૂળના લેખક કાજુઓ ઇશિગુરો બન્યા વિનર
- * **ફિઝિક્સ:** ગુરુત્વાકર્ષણ તરંગોની શોધ કરનારા રાઇનર વેઇઝ, બેરી બેરિશ અને કિપ એસ. થોર્ન બન્યા વિનર
- * **કેમેસ્ટ્રી:** બાયોકેમેસ્ટ્રીમાં કાયો-ઇલેક્ટ્રોન માઇક્રોસ્કોપી ડેવલપ કરવા બદલ સ્વિત્ઝર્લેન્ડના વૈજ્ઞાનિક જૈક ડુબોશે, જર્મનીના જોઆકિમ ફ્રેંક અને સ્કોટલેન્ડના રિચર્ડ ફેન્ડરસને એનાયત

1 Practice is a Best Way For Success | www.gkgrips.com

Download Our **Gkgrips** Android Application



રાજ્યમાં પશુઓની સારવાર માટે કૃષ્ણા એનિમલ એમ્બ્યુલન્સ 1962નો પ્રારંભ

રાજ્યમાં પશુઓની સારવાર માટે કૃષ્ણા એનિમલ એમ્બ્યુલન્સ 1962નો પ્રારંભ કરાયો છે. પહેલા તબક્કામાં અમદાવાદ, રાજકોટ, સુરત અને વડોદરા જિલ્લામાં પ્રારંભ કરવામાં આવ્યો છે. 1962 ઉપર કોલ કરવાથી રસ્તા ઉપર અથવા અન્ય અકસ્માત સ્થળે ઘાયલ થયેલા પશુ-પક્ષીઓની સારવાર કરવામાં આવશે. ગાંધીનગર સિવિલ હોસ્પિટલ સંકુલ ઓડિટોરિયમમાં આ સેવાનો આરંભ થયો છે.

ગુજરાતના પહેલા ગ્રીન ફિલ્ડ એરપોર્ટનું ખાતમુહૂર્ત

રાજકોટથી 20 કિમી દુર કુવાડવા નજીક હીરાસર ગામ પાસે 1405 કરોડના ખર્ચે તૈયાર થનાર વિશ્વકક્ષાના આધુનિક એરપોર્ટનું ખાતમુહૂર્ત વડાપ્રધાન શ્રીનરેન્દ્રમોદી દ્વારા કરવામાં આવ્યું છે. 1025 હેક્ટરમાં આકાર લઈ રહેલા એરપોર્ટનો રનવે 3080 મીટર લાંબો અને 45 મીટર પહોળો હશે. આગામી ચાર વર્ષમાં આ એરપોર્ટ કાર્યરત થઈ જશે.

ઓખા અને બેટ દ્વારકા વચ્ચે કેબલ સ્ટેઇડ સિગ્નેચર બ્રીજ

ઓખા અને બેટ દ્વારકાની વચ્ચે ૯૬૨ કરોડના ખર્ચે સમુદ્ર પર કેબલ સ્ટેપ સિગ્નેચર બ્રીજ તૈયાર થશે. આ બ્રીજ ચાર માર્ગીય અને 4.56 કિમી લાંબો હશે. બ્રીજની પહોળાઈ 27.20 મીટર હશે. આગામી 30 મહિનામાં આ બ્રીજ પૂર્ણ કરવાની યોજના છે. વડાપ્રધાન નરેન્દ્રમોદી દ્વારા આ યોજનાનું ખાતમુહૂર્ત કરવામાં આવ્યું હતું.

2 Practice is a Best Way For Success | www.gkgrips.com

Download Our **Gkgrips** Android Application



દેવભૂમિ દ્વારકા જીલ્લામાં દેશની પ્રથમ મરીન પોલીસ રીચર્સ ઇન્સ્ટીટ્યુટ

ઓખામંડળ સરહદીય દ્રષ્ટિએ સંવેદનશીલ વિસ્તાર છે તે માટે આધુનિક ટેકનોલોજીના માધ્યમથી સમુદ્ર કિનારાની સુરક્ષા યોગ્ય રીતે થઈ શકે તે માટે દેશનું પ્રથમ મરીન પોલીસ ટ્રેનીંગ સેન્ટર દેવભૂમિ દ્વારકા જીલ્લાના મોજપ ગામે સ્થાપવામાં આવશે.

હારી નથી ગયો, જીતીને બતાવીશ સમય ખરાબ છે હું નહિ

Gkgrips ટેલીગ્રામ ચેનલમાં જોડવા અહી ક્લિક કરો...

Gkgrips એપ્લિકેશન ડાઉનલોડ કરવા અહી ક્લિક કરો....

3 Practice is a Best Way For Success | www.gkgrips.com

Download Our **Gkgrips** Android Application

